

**National Scholarship Portal ની વેબસાઈટ - [www.scholarships.gov.in](http://www.scholarships.gov.in) પર ONLINE અરજી કરવાની જાહેરાત**

ભારત સરકારશ્રીના અલ્પસંખ્યક કાર્યમંત્રાલય, નવી દિલ્હી ધ્વારા અમલીત “મુસ્લીમ, ખ્રિસ્તી, શીખ, પારસી, બૌદ્ધ, જૈન” જેવા ધાર્મિક લઘુમતીના વિદ્યાર્થીઓ માટે “પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના”, “પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના” અને “મેરીટ કમ મીન્સ-શિષ્યવૃત્તિ યોજના”.

ગુજરાત સરકાર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ધાર્મિક લઘુમતી કોમના વિદ્યાર્થીઓ કે જેઓને આ યોજના હેઠળ અગાઉ શિષ્યવૃત્તિનો લાભ મળેલ ન હોય તેવા નવા(FRESH) વિદ્યાર્થીઓ તેમજ અગાઉ આ યોજના હેઠળ લાભ મેળવેલ હોય અને તેઓનો અભ્યાસ ચાલુ હોય અને યોજનાની શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા જુના(RENEWAL) વિદ્યાર્થીઓ પાસેથી વર્ષ ૨૦૧૯-૨૦ માં ઉપરોક્ત “પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના”, “પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના” તેમજ “મેરીટ કમ મીન્સ-શિષ્યવૃત્તિ યોજના”, માટેની શિષ્યવૃત્તિ મેળવવા નીચેની શરતોને આધીન રહી **ONLINE** અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીઓ ONLINE રજૂ કરવાની હોય વિદ્યાર્થીઓ દ્વારા ઉપરોક્ત દર્શાવેલ [www.scholarships.gov.in](http://www.scholarships.gov.in) વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે. જુના(RENEWAL) વિદ્યાર્થીઓ પોતાનો ગત વર્ષના અરજીનો ID નો ઉપયોગ કરીને અરજી કરી શકશે. ગત વર્ષે ONLINE અરજી કરેલ હોય અને શિષ્યવૃત્તિ મંજૂર થયેલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ જો જે તે અભ્યાસક્રમ ચાલુ હોય તો વર્ષ ૨૦૧૯-૨૦માં નવા(FRESH) તરીકે ONLINE અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા આપેલ બેંક Account શિષ્યવૃત્તિની પ્રક્રિયા દરમિયાન બેંક ખાતુ Active રાખવાની જવાબદારી તથા મંજૂર થયેલ શિષ્યવૃત્તિની રકમ જમા કરાવતી વખતે બેંક Account બંધ માલુમ પડશે તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીઓ/વાલીની રહેશે. જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ ૫૦,૦૦૦/- થી ઓછી હોય તેવા (પ્રિ-મેટ્રિક / પોસ્ટ-મેટ્રિક) ના અરજદારે સાધનિક પુરાવા Upload કરવાના થતા નથી પરંતુ તેઓની Online Submit કરેલ અરજીની નકલ સાથે ડોમીસાઇલ સર્ટીફિકેટ/ રેશન કાર્ડ / લાઇટ બીલ તથા અન્ય જરૂરી સાધનિક પુરાવા શાળા/કોલેજ/સંસ્થા લેવેલે હાર્ડકોપી જમા કરાવવાની થશે અને જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ ૫૦,૦૦૦/- થી વધુ હોય તેવા (મેરીટ કમ મીન્સ) વિદ્યાર્થીઓએ Online Submit કરેલ અરજીની નકલ સાથે ફરજિયાત ડોમીસાઇલ સર્ટીફિકેટ તથા અન્ય લાગુ પડતા સાધનિક પુરાવા પોર્ટલ પર અપલોડ કરવાના તેમજ શાળા/કોલેજ/સંસ્થા લેવેલે હાર્ડકોપી જમા કરાવવાની રહેશે.

યોજનાનું નામ	વિદ્યાર્થીઓએ નવા (FRESH) / જુના (RENEWAL) અરજી ONLINE કરવાની છેલ્લી તારીખ	શાળા/કોલેજ/સંસ્થાઓએ નવા(FRESH) / જુના(RENEWAL) અરજીઓ અને Defect થયેલી અરજીઓને ONLINE Verification કરવાની છેલ્લી તારીખ
પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના	૧૫/૧૦/૨૦૧૯	૩૧/૧૦/૨૦૧૯
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના	૩૧/૧૦/૨૦૧૯	૧૫/૧૧/૨૦૧૯
મેરીટ કમ મીન્સ-શિષ્યવૃત્તિ યોજના	૩૧/૧૦/૨૦૧૯	૧૫/૧૧/૨૦૧૯

શાળા/કોલેજ/સંસ્થાઓએ કરવાની પ્રક્રિયા :-

શાળા/કોલેજ/સંસ્થાઓએ પોતાના ONLINE એકાઉન્ટમાં લોગીન થઈ SCRUTINY ની પ્રક્રિયા કરવાની રહેશે, જેમાં વિદ્યાર્થીની અરજીની ચકાસણી કરી તેને ઉપરોક્ત આપેલ સમય મર્યાદામાં ONLINE ફોરવર્ડ કરવાની રહેશે. જો શાળા/કોલેજ/સંસ્થાએ આગળની ONLINE પ્રક્રિયા કરી ફોરવર્ડ કરેલ ન હોય તો વિદ્યાર્થીની અરજી પર આગળની પ્રક્રિયા થઈ શકશે નહિ જેથી શાળા/કોલેજ/સંસ્થાઓએ ખાસ પોતાનો આઈ.ડી. તથા પાસવર્ડ જિલ્લા/રાજ્યકક્ષાએથી મેળવી લેવાના રહેશે. જે શાળા/કોલેજ/સંસ્થાઓએ ઉપરોક્ત WEBSITE માં પોતાની કોલેજનું લિસ્ટમાં નામ ન હોય તો તેવી શાળા/કોલેજ/સંસ્થાઓએ તા.૩૧/૦૭/૨૦૧૯ પહેલા જિલ્લા કચેરીનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. National Scholarship Portal પર Institute Login માં જઈ Operational Manual માં આપેલ To Fill Registration Form માં રહેલ સુચન મુજબ વર્ષ ૨૦૧૮-૧૯ ના કાર્યરત આઈ.ડી. તથા પાસવર્ડનો ઉપયોગ કરી વર્ષ ૨૦૧૯-૨૦ માટે Institute Registration ની પ્રક્રિયા કરવાની રહેશે. નવા આઈ.ડી. તથા પાસવર્ડ મેળવ્યા બાદ Login થઈ શાળા/કોલેજ/સંસ્થાઓએ ફરજિયાત પોતાની Profile Update કરવાની રહેશે. આ શિષ્યવૃત્તિ યોજનાની વધુ વિગત તથા Guidelines નીચે દર્શાવેલ WEBSITE પરથી મેળવી શકાશે.

1) [www.scholarships.gov.in](http://www.scholarships.gov.in) 2) [www.minorityaffairs.gov.in](http://www.minorityaffairs.gov.in) 3) <https://sje.gujarat.gov.in/ddcw/> → કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ

**ONLINE અરજીમાં UPLOAD કરવાના થતા આધાર-પુરાવા: -**

- આધાર કાર્ડ / Enrolment ID (ફરજિયાત) (Mandatory)
- ગુજરાત રાજ્યના નિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર (ડોમીસાઇલ સર્ટીફિકેટ/ રેશન કાર્ડ/ લાઇટ બીલ)
- નવા(FRESH) અને જુના(RENEWAL) વિદ્યાર્થીઓએ છેલ્લી પાસ કરેલી પરીક્ષાની માર્કશીટની નકલ (ફરજિયાત)
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો (ફરજિયાત)
- વિદ્યાર્થીના ધાર્મિક લઘુમતી હોવા અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો / સ્વપ્રમાણિત નકલ (ફરજિયાત) (ઉપરોક્ત WEBSITE નં-૨ માં આપેલ નમુનાં પ્રમાણે)
- વિદ્યાર્થી જે વર્ષ માટે શિષ્યવૃત્તિની અરજી કરેલ હોય તે વર્ષ માટે ભરેલ ટ્યુશન ફી, પરીક્ષા ફી તથા પ્રવેશ ફી ની પહોંચની ખરી નકલ (ફરજિયાત)
- વિદ્યાર્થીની બેન્ક પાસબુકની નકલ. (ફરજિયાત)
- વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

પ્રકાશ સોલંકી (IAS)

નિયામક

વિકસતી જાતિ કલ્યાણ

ગુજરાત રાજ્ય, ગાંધીનગર